


સાનિદ્ધય  
સાઇકોથેરેપી  
અન્ડ  
કાઉન્સેલિંગ સેન્ટર



ડૉ. નિશાંત એ. સૈની

એમ.ડી. સાઇકયાટ્રી મનોચિકિત્સક

માનસિક, મગજ, વ્યસનુમકિત અને મનોજાતિય રોગોના નિષ્ણાંત  
સાનિદ્ધય માનસિક અને મગજના રોગોની હોસ્પિટલ, પાલનપુર  
સાનિદ્ધય સાઇકોથેરેપી અન્ડ કાઉન્સેલિંગ સેન્ટર, પાલનપુર

# ખરેખર તમે કોણ છો તે જાણો છો ?????

- ⇒ આત્મવિશ્વાસ વધારવા શું કરવું ?
- ⇒ ઇન્ટરવ્યુ, લેક્ચર, ભાષણ, સ્ટેજ ઉપર જવાનો ડર કેવી રીતે દુર કરવો ?
- ⇒ યાદ શક્તિ કઈ રીતે વધારવી અને મેળવવી ?
- ⇒ વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાઓ અને કસોટીઓ માટે તૈયારી કઈ રીતે કરવી ?
- ⇒ સમયનું આચ્યોજન કઈ રીતે કરવું ?
- ⇒ પતિ, પલ્ની અને કૌટુંગિક ઘર્ષણો કઈ રીતે દુર કરવા ?
- ⇒ ગુસ્સો, ઉંમાદ કે કોઘને કઈ રીતે કાળુમાં કરવો ?
- ⇒ વારંવાર આવતી હિતાશા, નિરાશા, ચિંતા ને કઈ રીતે દુર કરવી ?
- ⇒ ડર, ફોબીએ કે ફડક ને કઈ રીતે કાળુમાં રાખતા શીખવું ?
- ⇒ વ્યાસનમુક્તિ માટે મનોબળ કઈ રીતે મજબુત રાખતા શીખવું ?
- ⇒ બાળકોને લગતી માનસિક સમસ્યાઓ, વર્તણુક સમસ્યાઓ, મંદ બુધ્યિ, મગજનો ઓછો વિકાસ, ચંચળતા, ગુસ્સો, અભ્યાસ ને લગતી સમસ્યાઓ, બખવા, બોલવા, વાંચવા અને યાદશક્તિની તકલિફો જેવી સમસ્યાઓ માટે શું કરવું ?
- ⇒ સેક્સ ઓજનુકેશન મનોજાતિય શિક્ષણ એટલે શું અને કચાથી મેળવવું ?
- ⇒ જીવનમાં રોજગરોજ સાઈકોથેરેપીનો ઉપયોગ કઈ રીતે કરી શકાય ?
- ⇒ છ્રેસ મુક્ત જીવન જીવવા માટે શું કરવું ?
- ⇒ માનસિક રોગ માટે સલાહ, સુચન અને માર્ગદર્શન કચાથી મેળવવું ?
- ⇒ આવા અનેક પ્રશ્નોનો ઉકેલ સાઈકોથેરેપી અને કાઉન્સેલિંગ છે.
- ⇒ આવા અનેક પ્રશ્નોના ઉકેલ માટે ઉત્તાર ગુજરાતમાં સર્વપ્રથમ વખત સાનિદ્ધિ સાઈકોથેરેપી એન્ડ કાઉન્સેલિંગ સેન્ટરમાં એકસાથે સાઈકોથેરેપી, કાઉન્સેલિંગ અને સાઈકોલોજુકલ ટેસ્ટિંગની સુવિધા નિશાંત સાઈકોથેરેપીસ્ટની ટીમ દ્વારા ઉપલબ્ધ થઈ ચુકી છે.
- ⇒ આ પુસ્તક દ્વારા સાઈકોથેરેપી વિધેની સરળ અને સચોટ માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે.
- ⇒ સાઈકોથેરેપી અને કાઉન્સેલિંગને સમજુઓ અને માનસિક સ્વારથ્ય માટે તેનો જીવનમાં યોગ્ય ઉપયોગ આજથી કરીએ તેવા ઉદ્દેશથી આ પુસ્તક સમાજને સમર્પિત.

ડૉ. નિશાંત એ. સૈની  
અમ.ડી. સાઈકયાદ્રી

## સાઈકોલોજી અને સાઈકોથેરેપી કાઉન્સેલિંગ

- ➡ સાઈકોલોજી વિષે આપણા ચમાજમાં હજુ પણ અઝ્ઞાનતા ફેલાયેલી છે.
- ➡ સાઈકોલોજીનો આપણા જીવનમાં ઉતારવું ઘણું જરૂરી છે.
- ➡ સાઈકોલોજી એ એક મનોપૈશાનિક પદ્ધતિ છે. આપણા રોજગારોજના જીવનમાં જનતી ઘટનાઓ, તણાવ મુકૃત રહેવા, નિર્ણય શરીત વધારવા, આત્મવિશ્વાસ કેળવવા અને જીવનના ઘડતર માટે સાઈકોલોજી ઉપયોગી છે.
- ➡ આપણા ધર્મ પુસ્તકો જેમકે ભાગ્યદ ગીતા, કુરાને શારીફ, બાઈબલ માં વધ્યવેલ ઉપદેશ એ એક પ્રકારની સાઈકોથેરેપી છે.
- ➡ આજના આધુનિક યુગમાં માનસિક સ્વારથ્ય નું મહત્વ શારીરિક સ્વારથ્ય કરતા પણ વધુ છે.
- ➡ માનસિક સ્વારથ્યના ઘડતર માટે વિવિધ સાઈકોથેરેપી ઉપયોગી થઈ શકે છે.
- ➡ સાઈકોથેરેપીનો ઉપયોગ માત્ર માનસિક બીમારીમાં થાય છે આવી વિચારસરણી ખોટી છે.
- ➡ સાઈકોથેરેપીનો ઉપયોગ પર્સનાલિટી સ્વભાવ ઘડતર માટે, વિધાર્થીઓ માટે, નોકરી કે વ્યવસાયમાં, સફળ વક્તા બનવા, વિવિધ સ્પષ્ટાત્મક કસોટીઓ માટે, પોતાની ક્ષમતાઓ જાણવા ઉપયોગી થાય છે.
- ➡ સાઈકોલોજીના વિવિધ વિભાગો વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગી છે.

## માનસિક બીમારી અને સાઈકોથેરેપી

- ➡ માનસિક બીમારીની સારવામાં દવાઓની સાથે સાથે સાઈકોથેરેપી સારવાર લેવામાં આવે તો બીમારી જલ્દીથી કાબુમાં આવી શકે છે.
- ➡ સાઈકોથેરેપીનો ઉપયોગ
  - બીમારીના લક્ષણો ઘટાડવા, કાબુમાં લાવવા, દુર કરવા, બદલવા કે બીજુ જગ્યાએ દોરવવા કામ આવે છે.
  - વર્તણુકની લાક્ષણીકતાઓ બદલવા કામ આવે છે.
  - સકારાત્મક સ્વભાવ કે વિચારસરણી કેળવવા કે પ્રોત્સાહીત કરવા કામ આવે છે.
  - ભવિષ્યામાં આવનાર તકલીફોનો સામનો કરવા, રોકવા કે દુર કરવા કામ આવે છે.
  - વ્યક્તિના જીવનની નકારાત્મક લાગણીઓ, કમજોરીઓ, નકારાત્મક વિચારો, ભૂતકાળની ખોટી ગ્રંથીઓ, ધારણાઓ ને દુર કરી સકારાત્મક સ્વભાવ કેળવવા કામ આવે છે.

# ઇન્ડિવીડ્યુલ કે પર્સનલ કાઉન્સોલિંગ અને સાઈકોથેરેપી

- દરેક વ્યક્તિને પોતાના અંગત પ્રશ્નો, તકલીફો, સમસ્યાઓ કે મુંઘણો હોય છે.
- આ પ્રકારના કાઉન્સોલિંગમાં વ્યક્તિના પ્રશ્નોનું નિરાકરણ કર્દ રીતે લાવવું તે સમજાવવામાં આવે છે.

## રૈશનલ બીહેવીયર થેરેપી

- આ થેરેપીમાં વ્યક્તિના ખોટા વિચારો, ખોટી ધારણાઓ, અશક્ય કે કાલ્પનિક માન્યતાઓ અને ઝઠીયુસ્ટાતાને સમજુનો દુર કરવામાં આવે છે.
- વ્યક્તિની કાલ્પનિક ધારણાઓ જેમકે હું બધાના દીલમાં જલ્દી વશી જાઓ છું, બધાં જ મને પ્રેમ કરે છે. હું જે કરુ તે યોગ્ય છે અને સાચું જ છે, મારામાં બધુજ કરવાની ક્ષમતા છે.
- આવા વિચારો વાળી વ્યક્તિ પોતાની ક્ષમતા બહારના સપના જોવા લાગે છે અને તેને પામવા નાહિકના ધમપણાડા કે નિષ્ફળ પ્રયત્ન કરે છે.
- હકીકતમાં આવી વ્યક્તિને પોતાની ક્ષમતાઓનો પરિચય હોતો નથી. તેથી તેઓ વારંવાર નિષ્ફળ પ્રયત્નો કરે છે અને પોતાના જીવનનો અમુલ્ય સમય વેડફે છે.
- આવી વ્યક્તિઓ ધીરે ધીરે દુનિયાને ખોટી ગણવા લાગે છે. અથવા જીજા ઉપર પોતાની નિષ્ફળતાનો દોષ ઠાલવે છે.
- આવી વ્યક્તિઓ ભોટેભાગે નિષ્ફળતા મળવા જીતાં પોતાની માન્યતા બદલી શકતા નથી.
- આવી વ્યક્તિઓ જીવનમાં ખોટા સપનાઓ દેખે છે, જેને પામવામાં વારંવાર માંગણી ઓ કરે છે.
- લાંબા સમયે આવી વ્યક્તિઓને લાગણીઓની સમસ્યાઓ, કૌટુંબિક ઘર્ષણ અને માનસિક અશાંતિ ઉત્પદ્ધ થાય છે.
- આ પ્રકારની વ્યક્તિઓને સાઈકોથેરેપી વડે તેમના ખોટા વિચારો, ગ્રંથીઓ, ખોટી લાક્ષણિકતાઓ, ખોટી ધારણાઓ ને દુર કરી આપવામાં આવે છે.
- આવી વ્યક્તિઓને તેમની સાચી ક્ષમતાઓ વિષે માહિતગાર કરી સકારાત્મક જીવન જીવવાની પદ્ધતીઓ શીખવાડાય છે.

## ગૃપ થેરેપી

- ➡ આ થેરેપીમાં નાના ગૃપ કે સમહુને એકસાથે સાઈકોથેરેપી આપવામાં આવે છે.
- ➡ આ થેરેપી વડે પરસ્પરની લાગણીઓ, લાગણીઓની અભિવ્યક્તિ, પોતાની તકલીફો કે મુંજુવણો ને દુર કરવાની વિવિધ પદ્ધતિઓ ને ગૃપમાં સમજાવવામાં આવે છે.
- ➡ ગૃપ થેરેપીમાં એકજ જિમારી કે તકલીફો વાળી વ્યક્તિનું ગૃપ બનાવવામાં આવે છે.
- ➡ આ થેરેપીમાં ગૃપની વ્યક્તિઓ એકબીજાની લાગણીઓ, સમસ્યાઓ, પ્રશ્નો કે તકલીફોને કઈ રીતે દુર કરવી તેની પરસ્પર મદદ કે સલાહ સુચન આપી શકે છે.
- ➡ વ્યસનમુક્તિ, હતાશા, ચિંતા કે ફડકી, કોઇ કે ગુસ્સા જેવા રોગોમાં ઉપયોગી થાય છે.
- ➡ ગૃપ થેરેપીમાં એક વ્યક્તિની તકલીફોનું નિરાકરણ ગૃપના અન્ય વ્યક્તિઓને શીખવવા મળે છે.
- ➡ ગૃપ થેરેપી વડે વ્યક્તિનો ડર, શરમ, સંકોચ; અઝાત ભય અને લઘુતાગ્રંથી ધીમે-ધીમે દુર થાય છે.
- ➡ આ થેરેપી વડે વ્યક્તિ સકારાત્મક બને છે અને ભવિષ્યમાં પોતાના વિચારો કે પ્રશ્નોની આપલે કરતા ડર કે સંકોચ દુર થાય છે.

## ફેમીલી થેરેપી

- ➡ કૌટુંબિક વિખયાદ આપણા સમાજની સૌથી જટિલ સમસ્યા છે જે દિવસે ને દિવસે વધી રહી છે.
- ➡ ફેમીલી થેરેપીમાં કૌટુંબિક સમસ્યાઓના નિરાકરણ માટે કુટુંબના બધાજ સદસ્યો(સભ્યો)ને સાઈકોથેરેપી આપવામાં આવે છે.
- ➡ આ થેરેપીમાં માનસિક જિમારી વાળી વ્યક્તિ માટે શું કરવું ? તે પણ સમજાવી કુટુંબના બધાજ સદસ્યોને સાઈકોથેરેપી સિટિંગ આપવામાં આવે છે.
- ➡ ફેમીલી થેરેપીમાં કુટુંબના બધાજ સદસ્યો પરસ્પરના આણબનાવ, તકલીફો, સમસ્યાઓ અને કુટુંબના સારા નરસા નિયમો વિષે સાઈકોલોજુસ્ટ સાથે ચર્ચા વિચારણા કરે છે.
- ➡ સાઈકોલોજુસ્ટ ફેમીલી ના સદસ્યોનું સાઈકોલોજુકલ એનાલિસિસ કે વિશ્વેષણ કરે છે.
- ➡ આ એનાલિસિસ કર્યા પછી સાઈકોલોજુસ્ટ બધાજ સદસ્યોને એકસાથે ગૃપમાં સાઈકોથેરેપી સિટિંગ આપવામાં આવે છે.
- ➡ જરૂર પડે તો ફેમીલીના અમુક સદસ્યોનું પર્સનલ સિટિંગ પણ આપવામાં આવે છે.
- ➡ ફેમીલી થેરેપી થી દર્દીની વર્તણુક, લાગણીઓ ની અભિવ્યક્તિઓ અને સારી નરસી ટેવો કે કુટેવો યોગ્ય રીતે જાણી અને યોગ્ય માર્ગદર્શન વડે દુર કરી શકાય છે.

→ દંડી જોડે કઈ રીતે રહેવું, કેવું વર્તન કરવું, તેની લાગણીઓ સમજવી, તેની ટીકા ટીપ્પણીના કરવી જેવી સલાહ સુચન અને બિમારીનું માર્ગદર્શન પણ ફેમીલી થેરેપીમાં સરળતાથી આપી શકાય છે.

## કાઉન્સેલિંગ

- કાઉન્સેલિંગ એ સાઇકોલોજીમાં ખુબજ મહત્વનું છે.
- જેમાં વ્યક્તિનું ઉડાણમાં એનાલિસિસ કરવામાં આવે છે.
- વર્તણુક કે સ્વભાવને લગતી સમર્થ્યાઓમાં કાઉન્સેલિંગ બહુજ ઉપયોગી નીવડે છે.

## બાળક માતા પિતાનું કાઉન્સેલિંગ

- બાળકના ઉછેર માટે આજના આધુનિક સમયમાં ઘણી બધી બાળતોનું દ્વારા રાખવું અતિ આવશ્યક બની ગયું છે.
- વ્યક્તિના સવારી વિકાસમાં એના બાળપણનું ઘડતર મહત્વનું છે.
- બાળકના માનસિક વિકાસના ઘડતરમાં માતાપિતા નો ભાગ ખુબજ મહત્વનો છે.
- આધુનિક યુગની વિવિધ શોધો જેમકે વિડિયો ગેમ, મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, ઈન્ટરનેટ, ટી.વી. સીનેમાં જેવા ઉપકરણોનો અતિરેક કે ખોટો ઉપયોગ બાળકના વિકાસને ગેરમાર્ગ દોરે છે.
- કેટલાક બાળકો વિવિધ વ્યસનનો કે દ્રગ્સના રવાડે ચઢી જતા હોય છે.
- આવા અનેક અવરોધો આગામ જતા માનસિક તકલીફો કે માનસિક બિમારી માટે જવાબદાર બને છે.
- દરેક વાતનો અતિરેક આગામ જતા વિનાશ નોતરે છે. દરેક ક્ષેત્રમાં સમતોલન જાળવવું જરૂરી છે.
- કાઉન્સેલિંગ વડે લાગણીઓ, સંપેદનાઓ, વર્તણુકને લગતી સમર્થ્યાઓ, અભ્યાસને લગતી સમર્થ્યાઓ, પરિક્ષાનો ડર, ચિંતા, અકારણ કોધ, ગુસ્સો, જુદ વગેરે જેવા અનેક પ્રશ્નોનું નિરાકરણ પેઝાનિક પદ્ધતિઓ અને સલાહ વડે માતા પિતાને શિખવવામાં આવે છે.
- માતા પિતા અને બાળક વચ્ચે ઉદ્ભવેલી લાગણીઓની ગેરસમજ કાઉન્સેલિંગ વડે દુર કરી શકાય છે.
- કાઉન્સેલિંગમાં બાળકનો તંદુરસ્ત અને સકારાત્મક માનસિક વિકાસ કઈ રીતે કરવો તેનું માર્ગદર્શન માતા પિતાને આપવમાં આવે છે.

## મરાઈટલ કાઉન્સેલિંગ અને કપલ થેરેપી

- ➡ આજના આધુનિક યુગમાં સંયુક્ત કે વિભક્ત કુટુંબમાં રહેતા પતિ પત્નીને સમાજમાં રહેતા ઘણીબધી તકલીફો અને આદરા સમયમાંથી પસાર થવું પડતું હોય છે.
- ➡ પતિ પત્નીને સમાજના રીતી રીવાજો, આધુનિક જીવન શૈલી, બાળકોનો ઉષેર, આર્થિક, સામાજિક અને કૌટુંબિક જવાબદારી, વિવિધ પ્રસંગો અને નોકરી કે ઘંધાના કામો વચ્ચે સંતુલન કરવું બહુજ અધિક છે.
- ➡ મરાઈટલ કાઉન્સેલિંગ દ્વારા તણાવ મુક્ત જીવન જીવવા અને સકારાત્મક અભિગમ વડે સમાજુક, આર્થિક અને કૌટુંબિક જવાબદારી નિભાવવા તેમજ પતિ પત્ની વચ્ચે ઉદ્ભવેલ ગેરસમજ કે લાગણીઓની સમસ્યાને સકારાત્મક રીતે નિરાકરણ લાવવાની સાઈકોથેરેપી આપવામાં આવે છે.
- ➡ આ થેરેપીમાં પતિ પત્નીને તેમની સમસ્યાઓ માટે અલગ અલગ રાખી સિટિંગ આપવામાં આવે છે. પ્રથમસિટિંગ પછી બાકીના સિટિંગમાં પતિ પત્નીને સાથે બેસાડી તેમના પ્રશ્નો કે તકલીફો નું સકારાત્મક રીતે નિરાકરણ લાવવા શીખવાડવામાં આવે છે.
- ➡ મરાઈટલ કાઉન્સેલિંગ દ્વારા પતિ પત્નીની લાગણીઓની સમસ્યાઓ, કૌટુંબિક તકલીફો, મનોજાતિય તકલીફો, બાળકોના પ્રશ્નો, અરસ પરસની ગેરસમજો, વહેમ, ગુર્જો, પસ્તાવો, કોઇ વગોરે જેવી સમસ્યાઓનું સાઈકોલોજીની વિવિધ પદ્ધતીઓ દ્વારા સમાધાન કરી સકારાત્મક જીવન જીવવાનું શીખવાડવામાં આવે છે.
- ➡ પ્રી મરાઈટલ કાઉન્સેલિંગમાં લગ્ન પહેલાજ આ બધી તકલીફો સામે કઈ રીતે રહેવું અને તેનો સામનો કઈ રીતે કરવો અને કઈ તકલીફ કે સમસ્યા આવે તો તેને સંતુલિત રહી કઈ રિતે દુર કરવી તે શીખવામાં આવે છે.
- ➡ મરાઈટલ એડજસ્ટમેન્ટ પ્રશ્નાવલી Marital Adjustment Questionnaire વડે પતિ પત્નીના પરસ્પર સંબંધનો આંક મેળવી સાઈકોથેરેપી આપી શકાય છે.

## અભ્યાસ માર્ગદર્શન (SCHOLATIC-ACADEMIC GUIDANCE)

- ➡ અભ્યાસ કઈ રીતે કરવો, કચા ધોરણમાં કઈ રીતે મહેનત કરવી તેનું માર્ગદર્શન આપવામાં આવે છે.
- ➡ બાળકને ગુજરાતી કે હિન્દી મીડીયમમાં મુકવા માટેની સલાહ માર્ગદર્શન આપવામાં આવે છે.
- ➡ બાળકને પહેલા સોપાન થી બારમાં ધોરણ સુધી કઈ રીતે ભણાવવા નાદેનું માર્ગદર્શન આપવામાં આવે છે.
- ➡ વિધાર્થી, માતા પિતા વડીલો અને શિક્ષકો માટે સ્ટ્રેસમુક્ત વાતાવરણમાં કઈ રીતે અભ્યાસ કરવો તેનું માર્ગદર્શન આપવામાં આવે છે.

## કારકિદી માર્ગદર્શન (CAREER GUIDANCE)

- ⇒ ધોરણ દસ કે બાર પછી શું કરવું ? તેનું માર્ગદર્શન.
- ⇒ ઉચ્ચ અંભ્યાસ માટે કઈ કારકિદી પસંદ કરવી અને કઈ રીતે મહેનત કરવી તે માટેનું માર્ગદર્શન,
- ⇒ કારકિદી પસંદ કર્યા પછી થતી મૂંગવણો અને માનસિક તણાવ કે સ્ટ્રેસ માટે કાઉન્સેલિંગ.

## વ્યવસાયલક્ષી માર્ગદર્શન (VOCATIONAL GUIDANCE)

- ⇒ વ્યવસાયમાં કઈ રીતે મહેનત કરવી, વ્યવસાયમાં કોઈ આણગામો કે માનસિક તણાવ માટે કાઉન્સેલિંગ.
- ⇒ વારંવાર અલગ અલગ વ્યવસાય બદલવા, વ્યવસાયમાં ટકવું નહિ કે મન લાગવું નહિ જેવી તકલીફો માટે સ્વભાવગત રોગ જવાબદાર હોઈ શકે છે.
- ⇒ કાઉન્સેલિંગ વડે સુધારી શકાય છે.

## વ્યસનમુક્તિ કાઉન્સેલિંગ (RECREATION THERAPY & MOTIVATION)

- ⇒ વ્યસનના લક્ષણો પ્રમાણે અલગ અલગ સાઈકોથેરેપીનો ઉપયોગ કરવામાં આવે છે.
- ⇒ સાઈકોથેરેપીમાં દર્દી સાથે વ્યસન વિષેની માહિતી મેળવી અને તેના લક્ષણો જાણી સારવાર કરવામાં આવે છે.
- ⇒ વ્યસનના બંધાણી ના વિચારો, લાગણીઓ, સંઘર્ષો, પરતાવો, વ્યસનના કારણો, તલપ, અન્ય માનસિક બિમારીઓ વગેરે જેવા ઐચારિક પરિબળોના અભ્યાસ કરી યોગ્ય સાઈકોથેરેપી ના સેશન આપવામાં આવે છે જેથી તેના વિચારો અને લક્ષણોને સાચી જગ્યાએ કેન્દ્રીત કરી વ્યસનમુક્ત કરી શકાય છે.
- ⇒ સાઈકોથેરેપીમાં દર્દી સાથે મનોપ્રેફાનિક ભાષામાં વાતચીત કરી તેના મનના વિચારો વિષ્લેષણ કરવામાં આવે છે.
- ⇒ લાંબા સમયની સાઈકોથેરેપી ને અંતે વ્યક્તિને ભવિષ્યમાં આવનારા સંઘર્ષોનો યોગ્ય સામનો કરી અનુકૂળ ઉકેલ લાવી શકાય તે માટે તૈયાર કરવામાં આવે છે.
- ⇒ બિહેવીયર થેરાપી, આયકોસોસિઅલ થેરાપી, ફેમીલી થેરાપી, ગ્રૂપથેરાપી, કોગનીટીય બિહેવીયર થેરેપી, રિલેફ પ્રિવેન્શન, સપોર્ટીય ઓક્સાપ્રેસીય થેરેપી, કોપીંગાફીલ, હાર્મ રિડક્ષન જેવી વિવિધ સારવાર વ્યસનમુક્ત માટે આપવામાં આવતી હોય છે.

## પ્રેરક બળ (MOTIVATION)

- ➡ હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ ફરી વ્યસનની લતે દર્દી ન ચઢે તેનો આધાર મોટીવેશન પ્રેરક બળ ઉપર છે.
- ➡ પ્રેરક બળની તીવ્રતા પ્રમાણે વ્યસનમુક્ત રહી શકાય છે.
- ➡ શરૂઆતના તબક્કામાં આ પ્રેરકબળ ઓછુ કે મંદ હોય છે. જે સાઈકોથેરેપીના સેશન દ્વારા વધારી શકાય છે.
- ➡ પ્રાર્થના, યોગ મેડીટેશન, દ્વારા, ચિંતન પણ પ્રેરકબળ વધારવામાં ઉપયોગી નીવડી શકે છે.
- ➡ આ બધા માર્ગો વ્યસનનીને વ્યસન છોડતી વખતે થતી તકલીફો સહન કરવા માનસિક સહારો પૂરો પાડે છે.
- ➡ વ્યસનમુક્તિ પછી લગભગ છ મહિના સુધી પ્રસંગોપાત કેફી દ્વારા લેવાની તલપ જાગતી હોય છે. જો કે આવી તલપ માત્ર થોડીકંજ કાણ પુરતી હોય છે. પ્રેરક બળ આ થોડીક કાણો અને અન્ય સમયે તલપનો સામનો કરવા મનોબળ ટકાવી રાખે છે.

## સાઈકોસેક્સુઅલ કાઉન્સેલિંગ

- ➡ સેકસ રોગ કે મનોજાતિય રોગો માટે સેકસ એજ્યુકેશન અને કાઉન્સેલિંગ ઉપયોગી છે.
- ➡ પતિ પત્ની જાતિય જીવનની તકલીફો માટે સેકસ એજ્યુકેશન અને કાઉન્સેલિંગ ઉપયોગી છે.

## સ્ટ્રેસ મેનેજમેન્ટ, રિલેક્ષેશન થેરેપી

- ➡ રોજબરોજના જીવનમાં આવતા સ્ટ્રેસ કે તાણાથી મુક્ત રહેવા માટે ઉપયોગી છે.

## લાઇફ સ્ટાઇલ મોડીફિકેશન :

- ➡ માનસિક સ્વસ્થય જાળવવા જીવન જીવવાની પદ્ધતિઓને બદલવા અને તણાવ મુક્ત જીવન જીવવા માટેની સલાહ અને સારવાર.

## ઓન્ગારથેરેપી

- ➡ વારંવાર અકારણ આવતા ગુજ્જાને કાંગુ કસ્વા, સ્વભાવની ઉગ્રતા કાંગુ કસ્વા અને માનસિક રીતે શાંત રહેવા આ થેરેપી ઉપયોગી છે.

## સાઈકોમેટ્રી

- ➡ આધુનિક યુગમાં વિવિધ સ્કુલો, યુનિવર્સિટી, સંસ્થાઓ, ઓધોગિક એકમો સાઈકોમેટ્રીક તપાસ, ટેક કે પરીક્ષણ પછીજ યોગ્ય વ્યક્તિને નોકરીમાં લે છે કે બઢતી આપે છે.

→ પર્સિનાલીટી, ઇન્ટેલીજન્સી, એપ્ટીટ્યુડ અને એટીટ્યુડ જેવા સાઈકોમેટ્રીક ટેસ્ટ વડે વ્યક્તિત્વ પોતાનો ગોધ્યીક વિકાસ જાણી શકે છે.

## આઈ.ક્યુ ટેસ્ટ

- આ ટેસ્ટ એક એનાલીસીસ છે જેમાં લોજુકલ રીગનિંગ, સ્પેટીઅલ ર્કીલ, મેથસ ર્કીલ, વર્જલ ર્કીલ, એનાલોજુ જેવા વિવિધ ગોધ્યીક પાસાઓનો ટેસ્ટ છે.
- આ કસોટી વ્યક્તિત્વના ગોધ્યીક વિકાસની ક્ષમતા આંકડા કે પર્સન્ટેજ સ્વરૂપે જતાવે છે.

## ઇ.ક્યુ ટેસ્ટ

- ઇમોશનલ ઇન્ટેલીજન્સી એટલે પોતાની, સમૃદ્ધાય કે અન્યની લાગણીઓનું મુલ્યાંકન, સમજણા કે કાલુમાં કરવાની વ્યક્તિત્વની પોતાની વિશેષતાનું મુલ્યાંકન.
- ઇમોશનલ ઇન્ટેલીજન્સી દ્વારા વ્યક્તિત્વની લાગણીઓનું મુલ્યાંકન કરવામાં આવે છે.
- ઇમોશનલ ઇન્ટેલીજન્સી થી વ્યક્તિત્વની લાગણીઓ માટેની વિચારસરણી, સમજણણશક્તિ અને વ્યવહાર શક્તિ ની વિશેષતા કે ક્ષમતા કે ઉદાપ જાણી શકાય છે.
- વ્યક્તિત્વની લાગણીઓની સમસ્યાઓ કે ઉદાપ જાણી તેને દુર કરી શકાય છે. વ્યક્તિત્વના પરસ્પરના લાગણીના સંબંધો સુધારી શકાય છે.

## એપ્ટીટ્યુડ ટેસ્ટ

- એપ્ટીટ્યુડ ટેસ્ટ કે કસોટી એ ઐઝાનિક સ્વરૂપે વ્યક્તિત્વમાં છુપાયેલી ક્ષમતાઓ જાણવા માટે વપરાય છે.
- એપ્ટીટ્યુડ અને એબીલીટી કસોટી વડે લોજુકલ રીગનિંગ ની પદ્ધતિ દ્વારા વ્યક્તિત્વની ઐચ્યારિક ક્ષમતાઓ જાણી શકાય છે.
- વ્યક્તિત્વ પોતાના હોદ્દા માટે સક્ષમ છે કે નહી તે જાણવા કેટલાક ઓઘોગિક એકમો આ ટેસ્ટ ઉપયોગમાં લેવાય છે.
- અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે સાચન્સ, કોર્મર્સ કે આર્ટ્સમાં જ્યા માટે આ ટેસ્ટ ઉપયોગી થાય છે.
- વિધાર્થીઓ માટે આ ટેસ્ટ વડે વિધાર્થીઓમાં છુપાયેલી ક્ષમતાઓ કે આવડત જાણી શકાય છે.

## પર્સનાલીટી ટેસ્ટ (PERSONALITY TEST)

- પર્સનાલીટી ટેસ્ટ કે કસોટી એ ઐઝાનિક સ્વરૂપે વ્યક્તિની લાગણીઓ, વિચારો અને વર્તણુકનો અભ્યાસ કરી વ્યક્તિના સ્વભાવના વિવિધ પાસાઓ જાણવા માટે વપરાય છે.
- વિવિધ ઘટનાઓ, પરિસ્થિતીઓ ના જવાબ વ્યક્તિને પુછવામાં આવે છે અને તેના જવાબને ઐઝાનિક રીતે ઓનાલીસીસ કરી પર્સનાલીટી કે સ્વભાવ ની જાણકારી મેળવી શકાય છે.
- વ્યક્તિનું પ્રેરક બળ, આત્મવિશ્વાસ, સમય ચુક્તા, નિર્ણય શક્તિ, રસ, એટીટ્યુડ અને કાર્યક્ષમતા જાણી શકાય છે.  
સ્વભાવની ખાખી જાણી શકાય છે.

## પ્રોજેક્ટીવ ટેસ્ટ (PROJECTIVE TEST)

- પ્રોજેક્ટીવ ટેસ્ટ કે કસોટી એ ઐઝાનિક સ્વરૂપે વ્યક્તિની લાગણીઓ, વિચારો અને વર્તણુકનો અભ્યાસ કરી વ્યક્તિના સ્વભાવના વિવિધ પાસાઓ જાણવા માટે વપરાય છે.
- વિવિધ ઘટનાઓ, શરૂઆતો, ચિત્રો ના જવાબ વ્યક્તિને પુછવામાં આવે છે અને તેના જવાબને ઐઝાનિક રીતે ઓનાલીસીસ કરી પર્સનાલીટી કે સ્વભાવ ની જાણકારી મેળવી શકાય છે.
- વ્યક્તિના અર્દ્ધજાગૃત મનમાં રહેલી દ્રોષ્યાઓ, તકલીફો, પ્રેરણો ને આ ટેસ્ટ વડે જાણી શકાય છે.

# સાનિધ્ય સાઈકોથેરેપી એન્ડ કાઉન્સેલિંગ સેન્ટર પાલનપુર

ડૉ. નિર્ણાત એ. સૈની અન્દ્ર ડૉ. સાઈક્યાટ્રી - મનોચિકિત્સક

• માનસિક અને મગજના રોગોના નિર્ણાત

• મનોજાતિય રોગોના નિર્ણાત (સેક્સ થેરાપીઝ)

• વ્યાસનમુક્ત સારવાર ના નિર્ણાત

• જાળ માનસિક રોગોના નિર્ણાત

સાઈકોલોજીસ્ટ - રાજેશ ભૂતાડીયા (અમ.એ. સાઈકોલોજી, પી.જી.ડી.આર.પી.)

## ઉપલબ્ધ સુવિધાઓ અને સારવાર :

### → એક થી બાર વર્ષ

- બુદ્ધિ આંક (Intelling Quotient) I.Q. Testing
- રસ કસોટી (Interest)
- ગુસ્સાનું પ્રમાણ (Agression)
- શાળા અને ઘરમાં અનુકૂલન (Adjustment at Home & School)
- સામાજિક અનુકૂલન (Social Maturity)

### → દસ થી અઠાર વર્ષ

- એપ્ટીટ્યુડ (Aptitude)
- લાગએન્ઝીલિટા (Emotional Quotinet) E.Q.
- કારકીર્દ (Career Guidance)
- વ્યકિંતત્વ (Personality)
- રસ કસોટી (Interest)
- ગુસ્સો (Agresion)

### → અઠાર વર્ષ થી ઉપર :

- વ્યકિંતત્વ વિશ્રલેખણ (Personality Analysis)
- વ્યવસાયલક્ષી માર્ગદર્શન (Vocational Guidance)
- આંતરીક સંબંધો (Interpersonal Relations)
- પ્રતિકારકતા અને અનુકૂલનની કણા (Defenses & Coping Strategies)
- આંતરીક જરૂરત, ધગશા અને અથડામણ (Inner Needs, Motives & Conflicts)

# ન્યુરો સાઇકયાંટ્રી ઇવેલ્યુઅશન

એમ. એમ. પી. આઈ.  
એમ. એમ. એસ. ઈ  
વિવિધ રેટિંગ સ્કેલ

## સાઇકોથેરેપી

- ફેમીલી થેરેપી ■ કપલ થેરેપી ■ મરાઇટલ કાઉન્સલિંગ ■ મોટીવેશન થેરેપી
- બીહેવીયર થેરેપી ■ એકેડેમીક ગાઈડન્સ ■ કેરીયર ગાઈડન્સ
- વોકેશનલ ગાઈડન્સ ■ સાઇકોસેક્સ્યુઅલ કાઉન્સલિંગ
- પર્સનાલિટી ડેવલપમેન્ટ એન્ડ બોડી લેન્વેજ ■ ગ્રૂપ થેરેપી
- ક્રેસ મેનેજમેન્ટ એન્ડ રીલેક્ષેશન થેરેપી ■ એન્ગાર થેરેપી ■ લાઇફ સ્ટ્રાટેજી
- મોડિફિકેશન

# સાનિધ્ય માનસિક અને મગજના રોગોની હોસ્પિટલ

## ઉપલબ્ધ સારવાર સુવિધાઓ :

### માનસિક રોગો :

ઉદાસીનતા, હતાશા, નિરાશા (ડિપ્રેશન), તણાવ, ચિંતા, ફડકી, તીવ્ર ઉશ્કેરાટ, કોઘ, અકારણ ગુર્ખો, ઉંમાં, એકજ વિચાર કે કિયાનું પુનરાવર્તન (ઓ.સી.ડી.), અનિદ્રા, અતિશોક વિલાપ, શંકા, વહેમ, ડર, બિક, વિચારવાચ્યું (સ્કીઝોફેનિયા), હિસ્ટેરીયા, આપદ્યાતના વિચારો, પાગલપન, વળગાડ કે બકવાસ કરવો.

### મગજના રોગો :

ચક્કર આવવા, ભૂલવાની જિમારી, અૃતિભ્રંશ (ડિમેન્શિયા), કંપવાત (પાર્કિંસોનિઝમ), ધૂજરી, જ્ઞાનતંત્ર અને મગજની નશોની તકલીફો, શરિરના હુલન ચલન ને લગતા રોગો.

### હેડેક કિલનીક :

માથાનો દુખાવો, શિરદ્દ, આધાશીશી માઈગ્રેન, વારક્યુલર હેડેક, ટેન્શન હેડેક, કલસ્ટર હેડેક, માથાની બળતરા, લાંબા સમયનો માથાનો દુખાવો, મગજ અને માથાના વિવિધ પ્રકારના દુખાવા, ગરદન અને મોટાના દુખાવા, ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા ની સારવાર.

### એપિલેપ્સી કિલનીક :

વાઈ, ખેંચ, તાણ, એપિલેપ્સી નું સચોટ નિદાન, સલાહ સારવાર.

### વ્યસનામુક્તિ કેન્દ્ર :

દારુ, અફીણ, ડોડા, ભાંગ ચરસ, ગાંઝો, તમાકુ જિડી સિગારેટ, નશીલી ઊંઘની દવાઓ જેવા વ્યસન માટે વ્યસનામુક્તિ સલાહ સારવાર.

### બાળ માનસિક રોગ સારવાર :

મંદબુધ્ય, બેદ્યાનપણું, અનિદ્રા, ચમકી જવું, પેશાબની તકલીફો, ચંચળતા, અતિશાય તોફાન કોઘ, કોઈ નું કલ્યાં માનવું નહિ, ભણાવામાં પાછાપડવું, ચાદન રહેવું, હતાશા, વિચારવાચ્યું, વિશીષ્ટ શિખવાની સમસ્યાઓ માટે સારવાર.

### એકેડેમીક ગાયડન્સ કિલનીક :

અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કેરીયર એકેડેમીક સ્કોલેટીક ગાયડન્સ.

## ● સાઈકોસેક્સુઅલ કિલનીક :

સેકસ રોગો મનોજાતિય રોગો માટે સલાહ સારવાર માર્ગદર્શન.

## ● કાઉન્સેલિંગ સેન્ટર :

સાઈકોથેરેપી સીટીંગ, ગુપ થેરેપી, ફેમીલી થેરેપી, મરાઈટલ કાઉન્સેલિંગ, બીહેવીયર થેરેપી, કોગનીટીવ થેરેપી અને વિવિધ સાઈકોથેરેપી સારવાર.

## ● જીરીઆટ્રીક સાઈક્યાટ્રીક કિલનીક :

વૃધ્ઘા અવસ્થા ની માનસિક બિમારીઓ જેમકે ઉદાસીનતા, વિચારવાચુ, અનિદ્રા, અમૃતિભ્રંશ, ભૂલવાની બિમારી, ઉન્માદ, બક્વાસ કરવો, માથુ દુખવુ, ચક્કર કે ખેંચ જેવા રોગોની સારવાર.

## ● ફિલેલ સાઈક્યાટ્રીક કિલનીક :

માસિકની શરૂઆત કે મેનોપોઝ તમેજ પ્રશ્નાની દરમિયાન કે પછી થતી માનસિક બિમારીઓની સારવાર. અકારણ ચીડીયા પણુ, કોઘ ગુસ્સો, જુદી વલણ કે સ્વભાવ, હતાશા નિરાશા ઉદાસીનતા, ચિંતા શરીરની બળતરા કે દુખાવો, માથુ દુખવુ, ડર, ભય, શંકા, વહેમ, ઊંઘની અનિયમીતતા, માથુ દુખવુ જેવા લક્ષણોની સારવાર.

## ● ઓબેસીટી કિલનીક :

વજન ઉતારવા, ફીટનેસ માટે અને સ્લીમિંગ તેમજ વેલનેસ માટે સલાહ સારવાર.

## ● માનસિક રોગ સલાહ સારવાર કેન્દ્ર :

માનસિક અને મગજના રોગો વિષે મુંજવતા પ્રશ્નો માટે ચોગ્ય સલાહ, માર્ગદર્શન, નિદાન અને સારવાર.

## ● ઇમરજન્સી સારવાર :

રે કલાક ઇમરજન્સી સારવાર ઉપલબ્ધ છે.

**સાનિધ્ય માનસિક રોગોની હોસ્પિટલ**

**સાનિધ્ય વ્યસન મુક્તિ કેન્દ્ર**

**સાનિધ્ય સાઇકોથેરાપી સેન્ટર**

**સાનિધી ફીડીયોથેરાપી અને ફીટનેસ સેન્ટર**

**ડૉ. નિરાંત એ. સૈની**

એમ.ડી. સાઇકયાટ્રી

ફોન: (૦૨૭૪૨) ૨૫૭૬૬૬

મો. ૯૪૨૬૬ ૨૨૦૬૬

મો. ૯૩૭૬૨ ૧૪૧૧૧

મો. ૯૪૨૬૫ ૧૭૬૬૬

**ડૉ. પ્રિયંકા એન. સૈની**

બી.પી.ટી.એમ.આઈ.એ.પી.

મો. ૯૪૨૬૬ ૨૨૦૭૭

**સાઇકોલોજિસ્ટ**

**રાજેશ ભુતડીયા**

એમ.એ. સાઇકોલોજી, પી.જી.ડી.આર.પી.

મો. ૯૪૨૬૧ ૬૩૫૦૮

**-: મેનેજ્મેન્ટ ડીરેક્ટર :-**

કુમલેશભાઈ પટેલ મો. ૯૪૨૮૫ ૫૮૬૭૮

**-: હોસ્પિટલ હેવ્યલાઈન :-**

જ્યેશભાઈ સોલંકી મો. ૯૯૭૪૧ ૦૨૩૬૭

**આધુનિક યુગમાં માનસિક સ્વાસ્થ્ય શારીરિક સ્વાસ્થ્ય કરતા વધુ મહત્વનું છે.**

**સાઈકોથેરેપી અને કાઉન્સેલિંગ ઓક પ્રકારની મનોપૈશાનિક સારવાર છે.**

**માનસિક સ્વાસ્થ્યના ઘડતર માટે વિવિધ સાઈકોથેરેપી ઉપયોગી થઈ શકે છે.**

**સાઈકોથેરેપીનો ઉપયોગ સ્વભાવ ઘડતર માટે, વિધાર્થીઓ માટે, નોકરી કે વ્યવસાયમાં, સફળ વકતા બનવા, વિવિધ સ્પર્ધાત્મક કસોટીઓ માટે પોતાની ક્ષમતાઓ જાળવા ઉપયોગી થાય છે.**

**આજના આધુનિક યુગમાં માનસિક રોગ ની સારવાર શક્ય છે.**

**માનસિક રોગ થી ડર્ચા કે શરમાયા કે પસ્તાવો કર્યા વગાર તેનો સ્વિકાર કરો, સામનો કરો અને દવા નિયમિત લો અને સકારાત્મક જીવન જીવો.**

**માનસિક બીમારી ને સમજુઓ અને તેની યોગ્ય સારવાર કરવાનો પ્રયાસ આજથી કરીએ.**

## **સાનિદ્ધય સાઈકોથેરેપી એન્ડ કાઉન્સેલિંગ સેન્ટર પાલનપુર સાનિદ્ધય માનસિક અને મગજના રોગોની હોસ્પિટલ**

**સરનામું :- જીજો માળ, સાંઈ કોમ્પ્લેક્સ, ગોબરી રોડ, ગઠામણ દરવાજા, પાલનપુર**

**સમય : સવારે ૬:૦૦ થી ૨:૩૦ સાંજે ૫:૦૦ થી ૭:૩૦ (સોમવારથી શનિવાર)**

**કલીનીક : ૦૨૭૪૨ - ૨૫૭૬૬૬**

**મોબાઇલ : ૦૯૪૨૬૬૨૨૦૫૯ મોબાઇલ : ૦૯૩૭૯૨૧૪૧૧૧**